

National Stock Exchange of India Ltd. "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai – 400 051.	BSE Ltd. Corporate Relationship Department, 27 th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001.
Scrip Symbol : APARINDS	Scrip Code : 532259
<u>Kind Attn.: The Manager, Listing Dept.</u>	<u>Kind Attn. : Corporate Relationship Dept.</u>

Sub: Submission of publication of advertisement regarding 33rd Annual General Meeting in the newspapers (Post-dispatch)

Ref: Intimation under Regulation 30 and all other applicable regulations, if any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir,

Pursuant to Regulation 30 read with Schedule III - Part A - Para A of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, please find enclosed herewith the copies of newspaper advertisement published in Business Standard, (English language newspaper having Nationwide Circulation) and Vadodara Samachar, (Gujarati language newspaper) at Vadodara, in compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and the Secretarial Standards of General Meetings issued by the Institute of Company Secretaries of India, intimating that 33rd Annual General Meeting of the Company will be held on Friday, August 12, 2022 at 2.30 pm (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

The above information is also available on the website of the Company www.apar.com.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,
For APAR Industries Limited



(Harishkumar Malsatter)
Deputy Manager – Secretarial

Encl.: As above

APAR Industries Limited

Regd Office: 301/306, Panorama Complex, RC Dutt Road, Alkapuri, Vadodara - 390007, India
+91 265 6178 700/6178 709 apar_baroda@apar.com www.apar.com

Corporate Office: APAR House, Corporate Park, V N Purav Marg, Chembur, Mumbai 400 071, India
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802



Notice under Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	4334139 & 23308813	Loan Against Property	1. Mahakali Dairy And Provisional Store 2. Roshani Tiwari 3. Suresh Chaturbhai Patel	08.07.2022	INR 11,33,312,77/-	All That Piece And Parcel Of Immovable Property, Premises Shop No. 14, Admeasuring 75 Sq. Fts. i.e. 6.97 Sq. Mtrs. (built Up Area) & Admeasuring 67 Sq. Fts. i.e. 6.23 Sq. Mtrs. (carpet Area) And Premises Shop No. 15, Admeasuring 97 Sq. Fts. i.e. 9.02 Sq. Mtrs. (built Up Area) & Admeasuring 90 Sq. Ft. i.e. 8.36 Sq. Mtrs. (carpet Area), Alongwith Proportionate Undivided Share In Ground Land In Apartment, Building "building No. C", "ground Floor", "hans Day Residency" Developed Upon Land Situated At State: Gujarat, District: Surat, Sub-district & Taluka: Choryasi, Moje: Village Deladva (gamtal) Bearing City Survey North Nos. 204 & 195, And Bounded As : East : Society Road, West : Shop No. 13, North : Main Road South : Apt. Parking.

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/
 Authorized Officer
 IDFC First Bank Limited
 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
 Date : 15.07.2022
 Place : Surat



Sayedpura Branch : Swaminarayan Bhavan, Hathupura Char Rasta, Sayedpura, Surat - 395003. Phone No. : 0261-2417433, E-mail : sayedp@bankofbaroda.com

DEMAND NOTICE
 (Under Sub-Section (2) of Section 13 of the SARFAESI Act, 2002)

To,
 M/s. Carewell Packaging Industries (Borrower) Prop. Mrs. Samta Jenishkumar Shah
 Business Address : C-1/70, C-1/71, C-1/72, Bhagwati Industrial Estate, Bhestan, Surat - 394210.
 Mr. Taraben Sureshchandra Shah (Guarantor)
 A/42, Laxmi Row House, B/h. Sai Baba Nagar, Nr. Jivan Rakshak Hospital, Sayan Delad Road, Vill -Delad, Ta. Olpad, Dist : Surat.
 Date : 06.06.2022

Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" /A/c M/s. Carewell Packaging Industries, Prop. Mrs. Samta Jenishkumar Shah.
 Dear Sir/s, - Ref: Credit facilities with our Bank of Baroda, Sayedpura Branch, Surat
 1. We refer to our letter dated 14.03.2017 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Type of Facility	Limit	Rates of Interest	O/s as on 30.05.2022 (inclusive of interest up to 29.05.2022)
Cash Credit Loan	Rs. 20,00,000/-	8.65%	Rs. 23,74,008.58 + unapplied interest from 30.05.2022 + legal & other charges
Term Loan	Rs. 26,00,000/-	8.30%	Rs. 28,67,822.06 + unapplied interest from 30.05.2022 + legal & other charges

SECURITY AGREEMENT WITH BRIEF DESCRIPTION OF SECURITIES

Primary Securities :- A). Exclusive charge by way of hypothecation on entire All the tangible/intangible (including Patent/ Trademark/Goodwill/brand or any other intellectual property rights) movable properties and assets the Borrower/s of whatsoever nature including plant, machinery, tools and accessories, stores, spares, relating to the plant, machinery, furniture, articles, Office equipments, computers, and things belonging to the Borrower/s and lying and being at their premises/factories at Plot No. C-1/70, C-1/71, C-1/72, Ground Floor, Bhagwati Industrial Estate, Bhestan - 394210, being movable properties and capable of passing by delivery, both present and future, whether installed or not and whether now lying or in cases and now being or at any time hereinafter during the continuance of this Agreement brought into or upon or at any time in course of transit to the premises/factories of the Borrower/s Plot No. C-1/70, C-1/71, C-1/72, Ground Floor, Bhagwati Industrial Estate, Bhestan - 394210, either by way of substitution or in addition or other place whatsoever and where so ever in the possession or occupation of the Borrower/s (hereinafter referred to as the "said assets").
B). The whole of the Borrower's Stock Both Present and Future
C). All the present and future books Debts (Hypothecation Agreement dated: 29/03/2017)
Collateral Securities :- Equitable Mortgage of Plot No. 42, Admeasuring area 96.15 sq.mtrs. along with undivided proportionate share adm. 63.17 sq.mtrs. in COP and Common Road (aggregate 159.32 sq.mtrs.) together construction three on "Laxmi Row House" vibhag A Situated on the Land Bearing R.S.No. 93, Block No. 140, of Village: Delad, Sub Dist. Olpad, Dist. Surat in the name of Mr. Taraben Sureshbhai Shah. Bounded by :- North : Plot No. 43, South : Plot No. 41, East : Plot No. 37, West : Society Road.

(2). As you are aware, you have committed defaults in payment of interests/Installments on above loans/outstandings for the on June - 2019 and thereafter. (3). Consequently upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 12.06.2019 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon. (4). Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 52,41,830.64 as on 30.05.2022 + unapplied interest from 30.05.2022 + Legal & Other Expenses as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note, (5). Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full, (6). We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act, (7). We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available, (8). Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.
 Sd/,
 Authorized Officer, Bank of Baroda, Surat
 Date : 06.06.2022, Place : Surat

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)
 CIN : L6510TN2014PLC097792
 Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031.
 Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022



**APPENDIX IV [Rule 8(1)]
 POSSESSION NOTICE (For immovable property)**

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notices calling upon the Borrower/Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Loan Account Number	Borrower/s/ Co-borrower/s & Guarantors Name	Description of The Mortgaged Properties	Demand Notice		Date and Type of Possession Taken
			Date	Outstanding Amount (Rs.)	
27911989, 27919806 & 33987486	1. Vijay Kumar Kantibhai Patel 2. Varshaben Vijaybhai Patel,	Property 1:- All That Piece And Parcel Of Immovable Property, Premises Of Shop No. 10 (As Per Approved Plan), Shop No. 110/A (As Per Private Site) Admeasuring 225.00 Sq. Fts., I.E. 20.91 Sq. Mtrs. (Carpet Area), Alongwith Construction, Having Proportionate Undivided Share In Ground Land, "First Floor", "Richmond Plaza", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub District & Taluka: Surat City, Moje: Vesu Bearing Old Revenue Survey No. 92, 93/4 & 139 After Revision New Survey Nos. 70, 71/4 & 74, T. P. Scheme No. 2 (Vesu-Bharthana-Vesu), Final Plot Nos. 9 & 27 Paikae Final Plot No. 27 N A Land Admeasuring 1505.00 Sq. Mtrs., Paikae. And Boundaries Of The Properties: East : Adjoining Final Plot No. 28, West : Adjoining Final Plot No. 26, North : Adjoining Final Plot No. 28, South : Adjoining Road Property 2:- All That Piece And Parcel Of Immovable Property, Premises Of Shop No. G/12 (As Per Approved Plan), Shop No. G/12a (As Per Private Site) Admeasuring 225.00 Sq. Fts., I.E. 20.91 Sq. Mtrs. (Carpet Area), Alongwith Construction, Having Proportionate Undivided Share In Ground Land, "Ground Floor", "Richmond Plaza", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub District & Taluka: Surat City, Moje: Vesu Bearing Old Revenue Survey No. 92, 93/4 & 139 After Revision New Survey Nos. 70, 71/4 & 74, T. P. Scheme No. 2 (Vesu-Bharthana-Vesu), Final Plot Nos. 9 & 27 Paikae Final Plot No. 27 N A Land Admeasuring 1505.00 Sq. Mtrs., Paikae. And Boundaries Of The Properties: East : Adjoining Final Plot No. 28, West : Adjoining Final Plot No. 26, North : Adjoining Final Plot No. 28, South : Adjoining Road	28-04-2022	Rs. 26,79,735.01/-	12-07-2022 Symbolic Possession
46701002	1. Taurik Tanjeer Khan 2. Gool Unisek Salon 3. Nilofar Khan	All That Piece And Parcel Of The Property Bearing Shop/Flat No. F1 On The 1st Floor, Admeasuring 466.98 Sq. Ft. (Carpet Area) & 488.93 Sq. Ft. (Built-Up Area), Along With Undivided Share In The Land Of "Coral Heights-Tower-F", Situate At Old Revenue Survey No. 82/1, New Block No. 122 Adm. He.0-94-99 Sq. Mts., T.P Scheme No. 9 (Palanpore-Bhesan), Final Plot No. 17 Adm. 4584 Sq. Mts., & Final Plot No. 21 Adm. 2287 Sq. Mts., Paiki Final Plot No. 17 Adm. 4584 Sq. Mts., Of Moje Palanpore, Ta. Adajan, Dist. Surat, And Bounded As East : Open Space/Stair/Of Adj. Resi. Flat, West : Open Space, North : Open Space, South : Passage/Shop No. F-2	20-04-2022	Rs. 37,03,463.71/-	12-07-2022 Symbolic Possession

The Borrower/Co-borrowers/ Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount mentioned in the demand notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

Sd/
 Authorized Officer
 IDFC First Bank Limited
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)
 Date : 12-07-2022
 Place : Surat

ORACLE

ORACLE FINANCIAL SERVICES SOFTWARE LIMITED

Regd. Office: Oracle Park, Off Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063
 Tel: +91 22 6718 3000; Fax: +91 22 6718 3001; CIN: L72200MH1989PLC053666
 Website: www.oracle.com/financialservices; E-mail: investors-vp-ofss_in_grp@oracle.com

NOTICE

Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

Shareholders are hereby informed that pursuant to the provisions of Section 124 and other applicable provisions of the Companies Act, 2013 ("the Act") and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, ("the Rules") as amended, the Final Dividend declared for the financial year 2014-15, which remained unclaimed for a period of seven years will be credited to Investor Education and Protection Fund Authority ("IEPF") on November 10, 2022. The corresponding shares on which dividends remain unclaimed for seven consecutive years will also be transferred to IEPF Account as per the procedure set out in the Rules. The Company has sent individual communication to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF as per the Rules. The complete details of all the shareholders whose shares are due for transfer to IEPF Account are available on the Company's website at www.oracle.com/financialservices. Shareholders are requested to refer the website of the Company to verify the details of their shares liable to be transferred to IEPF. Shareholders are requested to send the requisite documents, as mentioned in the communication, to M/s. KFin Technologies Limited, Registrar and Transfer Agent of the Company, to claim the unclaimed dividend amount on or before **October 1, 2022**.

In case the Company does not receive any communication from the concerned shareholders by **October 1, 2022**, the Company shall, with a view to comply with the requirements set out in the Rules, transfer the said unpaid dividend and corresponding shares to IEPF without further notice in compliance with the Rules. Shareholders may note that no claim shall lie against the Company in respect of unclaimed dividend and shares transferred to IEPF. The unclaimed dividend and the shares once transferred to IEPF, including benefits accruing thereon after the date of transfer can be claimed from IEPF Authority only after following the procedure prescribed under the Rules. For the purpose of claiming transferred shares and dividends, an application can be made to the IEPF Authority in prescribed Form IEPF-5, available at www.iepf.gov.in.

In case of any queries, the shareholders may contact M/s. KFin Technologies Limited, Registrar and Transfer Agent of the Company, viz., Unit: Oracle Financial Services Software Limited, Selenium, Tower - B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500032, Toll free No.: 1800 3094 001, email: einward.ris@kfintech.com.

For Oracle Financial Services Software Limited
 Sd/
 Onkarnath Banerjee
 Company Secretary & Compliance Officer

Mumbai
 July 15, 2022

APAR Industries Limited

(CIN : L91110GJ1989PLC012802)
 Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
 Phone : (0265) 2339906 Website : www.apar.com E-mail : com.sec@apar.com

NOTICE OF THE 33RD ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that:

- the Thirty-Third (33rd) Annual General Meeting (AGM) of the Shareholders of APAR Industries Limited ("the Company") will be held on **Friday, August 12, 2022 at 02:30 P.M. (IST)** through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) in compliance with General Circular No. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 02/2021 dated January 13, 2021, 21/2021 dated December 14, 2021 and 2/2022 dated May 5, 2022 and all other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs (MCA) from time to time and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities and Exchange Board of India (SEBI) from time to time (hereinafter collectively referred to as the "Circulars") vide which, companies are allowed to hold AGMs through VC/OAVM, without the physical presence of members at a common venue. Hence, the 33rd AGM of the Company shall be held through VC / OAVM to transact the business as set forth in the Notice of the 33rd AGM dated May 27, 2022. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- in compliance with the aforesaid Circulars, electronic copy of the Notice of the 33rd AGM along with Annual Report 2021-22 have been sent to all the members whose email addresses are registered with the Company / Registrar & Transfer Agent (RTA) / Depository Participant(s) (DPs). These documents are also available on the website of the Company at www.apar.com, Stock Exchange websites i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and also on the CDSL's website at <https://www.evotingindia.com>, an agency appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC. The dispatch of Notice of the AGM through e-mails has been completed on July 14, 2022.
- Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from **Saturday, August 6, 2022 to Friday, August 12, 2022, (both days inclusive)** for the purpose of 33rd AGM and to determine the names of the shareholders who shall be entitled to receive the dividend on Equity Shares of the Company for the Financial Year 2021-2022, subject to deduction of tax at source ("TDS") as applicable.
- In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the following information is available to the Shareholders of the Company:

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut-off-date **Friday, August 5, 2022**, may cast their vote electronically on the business as set forth in the Notice of the 33rd AGM dtd. May 27, 2022 through the electronic voting system of Central Depository Services (India) Limited (CDSL). All the members are hereby informed that -

- The business as set forth in the Notice of the 33rd AGM dated May 27, 2022, shall be transacted through remote e-voting and e-voting during the AGM;
 - The remote e-voting shall commence on Monday, August 8, 2022 (10.00 Hrs. IST);
 - The remote e-voting shall close on Thursday, August 11, 2022 (17:00 Hrs. IST);
 - The cut-off-date for determining the eligibility to vote by remote e-voting and / or e-voting system at the AGM shall be Friday, August 5, 2022;
 - Any person, who acquires equity shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding equity shares as on the cut-off-date may obtain / generate the login ID and password as per the instructions given in the Note no. 19 of the Notice of the 33rd AGM dtd. May 27, 2022.
 - Members may note that:
 - The remote e-voting module shall be disabled by CDSL beyond 17:00 Hrs. IST on Thursday, August 11, 2022 and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
 - The facility for e-voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM;
 - The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 - A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off-date shall only be entitled to avail the facility of remote e-voting and / or e-voting at the AGM and for participation at the AGM.
 - The manner of voting remotely, for members holding shares in dematerialized mode / physical mode and for members who have not registered their email addresses, is provided in the Notice of the AGM. The details are also available on the website of the Company www.apar.com.
 - Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants, are requested to register/ update the same with the Depository Participants with whom they maintain their demat accounts and Members holding shares in physical mode, who have not registered / updated their demat accounts / Bank Account details with the Company, are requested to register / update the same with the Company by sending an e-mail at investor.services@apar.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN along with Form ISR-1 in order to facilitate the Company to serve the documents through the electronic mode and to receive copies of the Annual Report 2021-22 along with the Notice of the 33rd AGM, instructions for remote e-voting & e-voting during AGM and instructions for participation in the AGM through VC.
- Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Account details along with Form ISR-1 on the link of RTA as given below:
https://www.linkintime.com.in/EmailReg/Email_Register.html
- The Company has appointed Mr. Hemang M. Mehta, Proprietor of M/s. H. M. Mehta & Associates, Practicing Company Secretary, Vadodara, Gujarat as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.
 - In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at www.evotingindia.com under help section and for any grievances connected with e-voting facility, may contact Mr. Rakesh Dalvi, Sr. Manager (022-23058542/ 43) at CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013 or call Toll Free No. 1800225533 or send an email to helpdesk.evoting@cdslindia.com. The members who require technical assistance to access and participate in the meeting through VC may contact the above help line numbers.

By Order of the Board
 For APAR Industries Limited
 Sanjaya Kunder
 Company Secretary
 Place : Mumbai
 Date : July 14, 2022



1911 से आपके लिए "केन्द्रित" "CENTRAL TO YOU SINCE 1911"

NOTICE INVITING TENDER

Central Bank Of India invites bids for tender no. 346 Dated 15.07.2022 RFP FOR EMPANELMENT OF CORPORATE BUSINESS CORRESPONDENTS FOR URBAN/METRO LOCATIONS FINANCIAL INCLUSION BANKING SERVICES THROUGH KIOSKS/NON KIOSKS for Central Bank Of India **Last date & Time for bid submission is 05.08.2022; 15:00 hours** technical bids will be opened on **05.08.2022; 16:00 hours** Hindi translation of this advertisement is available on our website. For details please visit our website : ["www.centralbankofindia.co.in"](http://www.centralbankofindia.co.in)
 Asstt.GeneralManager-FI

Public Notice

NOTICE is hereby given to public at large that the undersigned Advocate is investigating the title of immovable property bearing Plot No.37 in 'Arjun Farms' within Abhiyog Co-Operative Housing Society Limited belonging to (1) Archanaben Jitendrakumar Shah, (2) Nilesh Lalbhai Shah, (3) Shweta Sanjaykumar Shah, situate, lying and being at non agricultural land of New Block No.254 (Old Block No.411) of Mouje Rancharda, Taluka Kalol, District Gandhinagar and Sub District Kalol. It is noteworthy that Deceased Jitendrakumar Lalbhai Shah had executed his Last Will and Testament on dated 02/01/2020 and registered in the Office of Sub Registrar, Ahmedabad-2 (Vadaj) vide Sr. No.101. Pursuant to said Will and Testament he bequeathed his 1/3rd undivided share in the said property in favour of Archanaben Jitendrakumar Shah.

All persons having or claiming any right, title, claim, demand or estate interest in respect of the said property or to any part thereof by way of sale, exchange, mortgage, let, lease, lien, charge, maintenance, license, gift, inheritance, share, possession, easement, trust, bequest possession, assignment or encumbrance of whatsoever nature or otherwise are hereby requested to intimate to the undersigned in writing at the address mentioned below of any such claim accompanied with all necessary and supporting documents within 7 (seven) days from the date of publication hereof, failing which it shall be presumed that there are no claims and that claims, if any, have been waived off and the undersigned shall proceed to issue a Title Investigation Report.

Omkar Mishra, Advocate
 92/A, New York Tower-A
 Near Thaltej Char Rasta, Thaltej, Ahmedabad
 Place: Ahmedabad Near Thaltej Char Rasta, Thaltej, Ahmedabad
 Date: 14/07/2022 (M) 9426002949 / 079-48987659

APPENDIX IV

[See rule 8 (1)]

POSSESSION NOTICE
 (for immovable property)

Whereas, The undersigned being the Authorized Officer of **INDIABULLS HOUSING FINANCE LIMITED (CIN:L65922DL2005PLC136029)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated **28.12.2021** calling upon the Borrower(s) **SAPNA NAGAR AND RAJ KUMAR GUPTA** to repay the amount mentioned in the Notice being **Rs. 11,88,186.23 (Rupees Eleven Lakhs Eighty Eight Thousand One Hundred Eighty Six and Twenty Three Paise Only)** against Loan Account No. **HLSLUR00438088** as on **14.12.2021** and interest thereon within 60 days from the date of receipt of the said Notice.

The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken **symbolic possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on **12.07.2022**.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **INDIABULLS HOUSING FINANCE LIMITED** for an amount of **Rs. 11,88,186.23 (Rupees Eleven Lakhs Eighty Eight Thousand One Hundred Eighty Six and Twenty Three Paise Only)** as on **14.12.2021** and interest thereon.

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

ALL THAT PIECE AND PARCEL OF PLOT NO. 195/A ADMEASURING 300 SQ FT., TRUPTI NAGAR, NR. MILAN POINT, NEW BAMROLI ROAD, R.S.No.164/P, BLOCK NO. 274/A, T.P.S.No. 58/ F.P.No. 116, BAMROLI, SURAT, GUJARAT-394210 BOUNDARIES:

EAST : ADJOINING PLOT NO. 195
WEST : SOCIETY ROAD
NORTH : ADJOINING PLOT NO. 194/A
SOUTH : PLOT NO. 196/A

Date : 12.07.2022
 Place: SURAT
 Sd/
 AUTHORIZED OFFICER
 INDIABULLS HOUSING FINANCE LIMITED



Circle SASTRA, 6th Floor, Guarat Bhavan, Nr. M.J. Library, Ellisbridge, Ahmedabad - 380 006.

**Appendix-IV [Under Rule 8(1)]
 POSSESSION NOTICE (For Immovable Property)**

Whereas, the undersigned being the Authorised Officer of **Punjab National Bank**, under the Securitisation and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred upon me under section 13(12) read with rule

